



ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર

ACCREDITED GRADE "A" BY NAAC (CGPA 3.28)

માહિતી અને જનસંપર્ક વિભાગ

Website : www.ayurveduniversity.edu.in

Email : pro@ayurveduniversity.com ફોન : 0288-2556852

અખબારી યાદી નં.૪૯

વિષય:- નોંધાયેલા સ્નાતકોના વિભાગની મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ ફેર નોંધણી કરાવવા અંગે

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્ટેચ્યુટ નં.-2(1),(2)(a),(b) મુજબ લાયકાત ધરાવનાર વ્યક્તિઓ કે જેઓ નોંધાયેલા સ્નાતકો (રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ્સ) તરીકે પોતાના નામ દાખલ કરાવવા કે ફેર નોંધણી કરાવવા માંગતા હોય તે સર્વે પાસેથી નિયત કરવામાં આવેલ ફોર્મમાં ઓનલાઇન/ઓફલાઇન અરજીઓ ધ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવે છે.

નિયત અરજી ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ www.ayurveduniversity.edu.in ઉપરથી તા.10-10-2017 થી ઓનલાઇન ફોર્મ મુકવામાં આવશે અથવા યુનિવર્સિટી કાર્યાલયમાં નવી નોંધણીની અરજી ફી રૂપિયા 100/- ઓનલાઇન/ઓફલાઇન ભરવાની રહેશે P TJDH તાજેતરનો કલર ફોટોગ્રાફ, ડીગ્રી સર્ટીફિકેટ તેમજ અન્ય તમામ સર્ટીફિકેટની સ્વયંમ પ્રમાણિત નકલો સ્કેન કરીને ઓનલાઇન અરજી સાથે અપલોડ કરવાની રહેશે. આ અરજી ફોર્મ તથા ફી સ્વીકારવાની છેલ્લી તા.30-નવેમ્બર-2017 છે.

જે નોંધાયેલા સ્નાતકોની નોંધણીની મુદત 31-12-2017 ના રોજ પુરી થાય છે, તેવા તમામ નોંધાયેલા સ્નાતકો ફરી પોતાના નામો ચાલુ રાખવા માંગતા હોય તો તેઓએ ફોર્મ ભરીને આ અરજી ફોર્મ કુલસચિવશ્રી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરને રીન્યુલ ફીના રૂપિયા 5/- ઓનલાઇન અથવા હિસાબી શાખામાં રૂબરૂ રોકડા અથવા મનીઓર્ડરથી તા.14-12-2017 સુધીમાં મળી જાય તે રીતે અચુક પણે મોકલી આપવાના રહેશે. પુરી માહિતી વિનાની કે અધુરી ફી વાળી કે નક્કી કરેલ સમય મર્યાદામાં ન આવેલ અરજીઓ ધ્યાનમાં લઈ શકાશે નહીં. જે વ્યક્તિએ અગાઉ અરજી કરેલ છે, પરંતુ નિયમાનુસાર રદ થયેલ છે તેમણે નવેસરથી ઓનલાઇન/ઓફલાઇન અરજી કરવાની રહેશે. દરેક સ્નાતકોએ તાજેતરનો કલર ફોટોગ્રાફ તથા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ધ્વારા ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે અપાયેલ ચૂંટણીના ઓળખપત્રની સ્વયંમ પ્રમાણિત કરીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. નામ સરનામામાં ફેરફાર થયેલ હોય તો તેના આધાર પુરાવાની ઝેરોક્ષ નકલ પ્રમાણિત કરીને ઓનલાઇન/ઓફલાઇન અરજી સાથે અપલોડ કરવાની રહેશે.

નં.આયુ/યુનિ/માહિતી/૨/૨૦૧૭-૧૮/૨૩૬૩

તારીખ : ૧૬/૧૦/૨૦૧૭

પ્રતિ,

તંત્રીશ્રી/પ્રેસ પ્રતિનિધિશ્રી,

મહોદયશ્રી,

આપના સુપ્રસિદ્ધ અખબાર/ચેનલમાં જાહેર જનતાના લાભાર્થે બહોળી પ્રસિદ્ધિ મળે તે હેતુથી ઉપર્યુક્ત અખબારીયાદીને પ્રકાશિત/કરવા વિનંતી.

આભાર.

આપની વિશ્વાસુ

ઈ.માહિતી અને જનસંપર્ક અધિકારી

નકલ રવાના:

1. સર્વે પ્રેસ પ્રતિનિધિશ્રીઓ તરફ... ઇમેઇલ ધ્વારા
2. નાયબ માહિતી નિયામકશ્રી, લાલબગલો, જામનગર (સમાચાર માધ્યમોને મોકલવાની વિનંતી સાથે)
3. સર્વે વિભાગીય વડાશ્રીઓ તરફ... ઇમેઇલ ધ્વારા (આપના વિભાગમાં નોટીસબોર્ડમાં મૂકવાની વિનંતી સૂચના સાથે.)
(૧) બોટાનિકલ ગાર્ડન (૨) પ્રેસ વિભાગ
4. પીપીએસ ટુ વીસી, કુલપતિશ્રી કાર્યાલય (વેબસાઇટ પર પ્રસારિત કરવાની સૂચના સાથે)
5. તંત્રીશ્રી, ન્યૂઝ લેટર, નિયામકશ્રી, આઈ.પી.જી.ટી એન્ડ આર. એ., જામનગર
6. તંત્રીશ્રી, ન્યૂઝ ફલેશ, આચાર્યશ્રી, આઈ.એ.પી.એસ, જામનગર
7. Shri H.P.Jhala, IQAC CO-Ordinator .